

ગુજરાત વિધુત નિયંત્રક આયોગ, ગાંધીનગર

પ્રેસ નોટ

તા:03/0૪/૨૦૨૧

રાજ્ય સરકાર હસ્તકની વિજ ઉત્પાદન, વિજ પ્રવહન, વિજ વિતરણ કંપનીઓ તથા અન્ય વિજ વિતરણ કંપનીઓ દ્વારા જીઇઆરસી (બહુવર્ષિય પ્રશુલ્ક) વિનિયમો-૨૦૧૬ અનુસંધાને નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦નું ટુ-અપ અને નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨નાં પ્રશુલ્ક નિર્ધારણ માટે પીટીશનો દાખલ કરેલ. સદર પીટીશનો જીઇઆરસી (બહુવર્ષિય પ્રશુલ્ક) વિનિયમો-૨૦૧૬ અનુસંધાને નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦નાં ઓડીટેડ હિસાબો સાથે આયોગના નિર્દેશ મુજબ દાખલ કરેલ. આ પીટીશનો ઇલેક્ટ્રીસીટી એક્ટ, ૨૦૦૩ અને સંલગ્ન વિનિયમો અનુસંધાને રજીસ્ટર કરી પ્રશુલ્ક આદેશ આપવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ.

આ અરજીઓ જાહેર જનતાની ભાગીદારીની ખાતરી કરવા જાહેરમાં પ્રકાશિત કરવા કંપનીઓને નિર્દેશ આપવામાં આવેલ. સામાન્ય જનતા અને હિતધારકો પાસેથી વાંધાઓ/સુચનો મંગાવવાની વિસ્તૃત કાર્યવાહી કરવામાં આવેલ. આ વાંધાઓ સુચનોની ચકાસણી કરીને ૪, ૫ અને ૯ માર્ચ, ૨૦૨૧ નાં રોજ જાહેર સુનાવણી નિયત કરવામાં આવેલ. આ સુનાવણીમાં કેટલાક હિત ધરાવનારાઓએ, વ્યક્તિગત અને સંગઠનો સહિત આ સુનાવણીમાં ભાગ લીધો હતો.

આયોગ દ્વારા આ પીટીશનો પર આદેશ જારી કરેલ છે, પરંતુ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણીને કારણે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં હોય, યુજીવીસીએલ અને ટોરેન્ટ પાવર લિમીટેડ, અમદાવાદ-ગાંધીનગર વિસ્તાર) ના આદેશ જાહેર કરેલ નથી.

આદેશના મહત્વનાં/અગત્યનાં મુદ્દાઓ નીચે મુજબ છે:

- રાજ્ય સરકાર હસ્તકની વિજ વિતરણ કંપનીઓ તેમજ ટોરેન્ટ પાવર લિમીટેડ (સુરત વિસ્તાર) કંપની ના ગ્રાહકો માટે ના વિજ દરમાં કોઇ વધારો કરેલ નથી.
- જેટકોના પ્રવહન માટેના હાલના દર રૂ.૪૧૭૬.૪૪ પ્રતિ મેગાવોટ દિવસ (૩૫.૦૩ પૈસા પ્રતિ યુનિટ)માં નજીવો વધારો કરી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે દર પ્રતિ મેગાવોટ પ્રતિ દિવસ રૂ.૪૨૫૨.૩૭ (પ્રતિ યુનિટ દીઠ ૩૬.૪૨ પૈસા) નિર્ધારિત કરેલ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન પીજીવીસીએલ સિવાયની તમામ વિજ વિતરણ કંપનીઓ માટે વિતરણ ખોટ (ટી એન્ડ લોસ) લક્ષ્યાંક થી ઘણાં સારા નોંધાયેલ છે. આ માટેના આયોગ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ તથા વર્ષ ૨૦૨૧-૨૨ માટે ના લક્ષ્યાંકો નીચેના કોષ્ટક માં બતાવવામાં આવેલ છે;

ડિસ્કોમ	આયોગ દ્વારા મંજૂર કરાયેલ લક્ષ્ય વર્ષ ૨૦૧૯-૨૦	આયોગ દ્વારા મંજૂર કરાયેલ લક્ષ્ય વર્ષ ૨૦૨૧-૨૨
દક્ષિણ ગુજરાત વિજ કંપની	૯.૯૦%	૬.૫૦%
મધ્ય ગુજરાત વિજ કંપની	૧૧.૬૦%	૯.૦૦%
પશ્ચિમ ગુજરાત વિજ કંપની	૧૭.૦૦%	૧૬.૦૦%
ટીપીએલ - સુરત	૩.૬૪%	૩.૫૪%

રાજ્યની માલિકીના વિતરણ પરવાનેદારો (ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને પીજીવીસીએલ) માટે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે માન્ય વીજ ખરીદીનો ખર્ચ રૂ.૪.૩૦ પ્રતિ યુનિટ અને બેઝ એફપીપીપીએ ચાર્જ રૂ. ૧.૫૯ યુનિટ દીઠ નક્કી કરાયેલો હતો, ઉપરાંત રૂ.૪.૩૦ થી વધુ વીજ ખરીદીના ખર્ચમાં કોઈપણ વધારો એ વધારાનું એફપીપીપીએ ચાર્જ તરીકે માનવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે, આયોગે વીજ ખરીદી ખર્ચ ને રૂ.૪.૪૮ પ્રતિ યુનિટ મંજૂર કરેલ હોય અને તે મુજબ બેઝ એફપીપીપીએ સુધારીને રૂ.૧.૮૦ પ્રતિ યુનિટ (૪.૪૮ (-) ઓછા ૪.૩૦ = ૦.૧૮ + ટીએન્ડડી લોસિસ = ૦.૨૧ + (ઉમેરી ને) ૧.૫૯ = ૧.૮૦) નક્કી કરેલ છે.

બેઝ એફપીપીપીએ ચાર્જ એ ગ્રાહકોના વીજ બિલમાં લેવામાં આવતા કુલ એફપીપીપીએ ચાર્જની ગણતરીમાં અભિન્ન ભાગ છે અને એફપીપીપીએ ચાર્જ માટે પુન પ્રાપ્તિ પદ્ધતિમાં કોઈ ફેરફાર થયો નથી, તેથી રાજ્યના હસ્તક વિજ વિતરણ માલિકીના ગ્રાહકોના વીજ બિલમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે બેઝ એફપીપીપીએ ચાર્જ માં ફેરફાર થવાને કારણે કોઈ વધારો થશે નહીં.

ટોરેન્ટ પાવર લિમિટેડ (સુરત વિસ્તાર) માટે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે માન્ય વીજ ખરીદીનો ખર્ચ રૂ.૪.૭૭ પ્રતિ યુનિટ અને બેઝ એફપીપીપીએ ચાર્જ રૂ.૧.૩૮ પ્રતિ યુનિટ કરાયેલ. હવે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે, આયોગે વીજ ખરીદી ખર્ચ ને રૂ.૪.૮૫ પ્રતિ યુનિટ મંજૂર કરેલ છે, જ્યારે બેઝ એફપીપીપીએ રૂ.૧.૩૮ પ્રતિ યુનિટ ચાલુ રાખવામાં આવેલ છે.

રૂપવંત સિંહ (આઇએએસ)
સચિવ
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ,
ગાંધીનગર